

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ દ્વારા "નફાકારક ડેરી ઉદ્યોગ અને પશુપાલન વ્યવસ્થાપન"

અંતર્ગત "દૂધ અને દૂધ ની બનાવટો" વિશે કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ દ્વારા તા. ૫, ૭ અને ૧૭, માર્ચ ૨૦૨૨ દરમિયાન "નફાકારક ડેરી ઉદ્યોગ અને પશુપાલન વ્યવસ્થાપન" અંતર્ગત "દૂધ અને દૂધ ની બનાવટો" વિશે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામ મલાતજ અને દેવાતજ ના ૪૫ પશુપાલક ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમના પ્રથમ દિવસે કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડૉ. એ.સી. વૈદ્ય એ સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ સદર કાર્યક્રમ યોજવા પાછળનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ ડૉ. શ્રીકાંત બી. કાટોલે, વૈજ્ઞાનિક (પશુપાલન) દ્વારા દૂધની અગત્યતા, પશુઓને બાંધવાની જગ્યાએ સાફ સફાઈ રાખવી, કથીરીનો ઉપદ્રવ અટકાવવાનાં પગલાં, પશુઓને દરરોજ નવડાવવા, દૂધના વાસણો સ્વચ્છ રાખવા, પશુઓને રસીકરણ સમયસર કરાવતા રહેવું, દૂધની ઉત્પાદકતા કઈ રીતે વધારવી તથા તેની ગૂણવત્તા કઈ રીતે જાળવી રાખવી, તેની માહિતી આપેલ તેમજ પશુપાલનમાં નવી ટેકનોલોજી વિશે પણ વિસ્તૃતમાં ચર્ચા કરેલ

કાર્યક્રમના બીજા દિવસે ડૉ. એ.સી. વૈદ્ય દ્વારા નફાકારક પશુપાલનની મુખ્ય ચાવીઓ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી માં ચાલતા અભ્યાસક્રમોઅંગે સર્વેને માહિતી આપવામાં આવેલ. ડૉ. શ્રીકાંત બી. કાટોલે દ્વારા વાછરડીઓમાં આહાર વ્યવસ્થા તેમજ રસીકરણ વિશે માહિતી આપવામાં આવી હતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિદર્શન એકમની મુલાકાત પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમના ત્રીજા દિવસે ડૉ. શ્રીકાંત બી. કાટોલે એ સર્વેને જણાવેલ કે દૂધ એ બાળક, તરુણ, યુવાન, વૃદ્ધ દર્દીઓં દરેક માટે સંપૂર્ણ આહાર છે જેમાંથી બધા જ પોષકતત્વો મળે છે તેમજ દૂધમાં મૂલ્ય વર્ધન તથા તેની વાનગીઓ જેવી કે દહીં, પનીર, શ્રીખંડ, ઘી, વગેરેની બનાવટ વિશે પણ સમજણ આપેલ. તેમણે ખેડૂત ભાઈઓ તથા બહેનોને પશુઓને બાંધવાની જગ્યાએ સાફ સફાઈ રાખવી, પશુઓને દરરોજ નવડાવવા, દૂધના વાસણો સ્વચ્છ રાખવા વગેરે બાબતો વિશે માહિતી આપી. કાર્યક્રમના ચર્ચા સત્રમાં પશુપાલકોની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રોગ્રામનું આયોજન તેમજ સંચાલન ડૉ. શ્રીકાંત બી. કાટોલે દ્વારા માનનીય કુલપતિશ્રી, આકૃયુ., આણંદ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.

કાર્યક્રમની ઝાંખીઓ

